

B.A. Semester - 2 (CBCS) Examination**June/July-2022 [OLD COURSE]****ECONOMICS : P3 PRINCIPLES OF ECO-2(ELECTIVE-2)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન.૧	ઘટતા મળતરનો નિયમ સમજાવો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૧	વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો.	
પ્રશ્ન.૨	“બદલા કમાણી કરતાં જે વધારાની આવક થાય છે તે ભાડું છે” – આધુનિક ભાડાના સિદ્ધાંતના સંદર્ભમાં આ વિધાન તપાસો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૨	સ્થિરખર્ચ અને અસ્થિરખર્ચના ખ્યાલો ઉદાહરણ અને આકૃતિની મદદથી સમજાવો.	
પ્રશ્ન.૩	સરેરાશખર્ચ અને સીમાંતખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૩	“નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો.	
પ્રશ્ન.૪	સાધનના મૂલ્ય નિર્ધારણનો પ્રશ્ન શામાટે અલગ રીતે વિચારવામાં આવે છે?	(૧૪)
	અથવા	
પ્રશ્ન.૪	પેઢી અને ઉદ્યોગ વિકાસના લાભોની ચર્ચા કરો.	
પ્રશ્ન.૫	ટૂંકનોંધ લખો. (કોઈપણ બે)	(૧૪)
	(1) કાચો નફો અને શુદ્ધ નફો વચ્ચેનો તફાવત.	
	(2) આભાસી ભાડું.	
	(3) નફો અને નવપ્રવર્તન.	
	(4) એકમ વિકાસના ગેરલાભો.	

ENGLISH VERSION

Q.1	Explain the law of diminishing returns.	(14)
	OR	
Q.1	Explain the concept of opportunity cost with the help of illustration.	
Q.2	“rent is incurred if there is surplus over transfer earning” – examine the statement with reference of modern theory of rent.	(14)
	OR	
Q.2	Explain the concept of fixed cost and variable cost with the help of illustration and figure.	
Q.3	Clarify the interrelationships between average cost and marginal cost with the help by diagram.	(14)
	OR	
Q.3	“profit is a result of innovation” – discuss.	
Q.4	Why does the issue of price determination of factors of production are separately thought?	(14)
	OR	
Q.4	Discuss the advantages of expansions size of firm and industry.	
Q.5	Write short notes: (any two)	(14)
	(1) Difference between gross profit & net profit.	
	(2) Quasi-rent.	
	(3) Profit and innovation.	
	(4) The disadvantages of expansion size of firm.	
